

જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩
કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૨૬/૦૮/૨૦૧૮ રવિવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૬૪૭/૧૮

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૧૯ કેસ કરી, ૧૭ વ્યક્તિઓને ઝડપી, ૧૦૭ લીટર દેશી દારૂ, ૮૨૪ બોટલ ઇંગ્લીશ દારૂ, ૨૬૪ બિયર ટીન અને ૧ કાર કબજે કરી હતી. તેમજ જુગાર ધારા હેઠળ ૩ કેસ કરી ૨૫ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૨,૮૮,૬૦૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૬૪૮/૧૮

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૭૫ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી ૯૩ મુજબ ૧ વ્યક્તિની અને પાસા હેઠળ ૪ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

ઘરફોડ:-

સમાચાર યાદી નં.૧૬૪૯/૧૮

કૃષ્ણનગર: રમેશકુમાર વરધીચંદ શાહ (રહે.પાશ્વનાથ ટાઉનશીપ નવા નરોડા) એ કૃષ્ણનગર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૪/૮/૧૮ રાતના ૧૧/૦૦ થી તા.૨૫/૮/૧૮ કલાક ૫/૦૦ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન પોતાના રહેણાંકના નીચે નાકોડા જવેલર્સ તથા નકોડા જનરલ સ્ટોર્સ નામની દુકાનના તાળા અને નકુચા તોડી અજાણી વ્યક્તિ દુકાનમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા મળી કુલ રૂપિયા ૯,૪૧,૦૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.ઇ.શ્રી વિ.આર.ચોધરી ચલાવે છે.

સોનાની ચેઈન/ મંગળસુત્ર ખેચી તોડી લઈ ગયા:-

સમાચાર યાદી નં.૧૬૫૦/૧૮

સાબરમતી: પાણલબહેન બીપીનચંદ્ર શાહ (ઉ.વ.૫૮) (રહે. નવકાર એપાર્ટમેન્ટ પાણીની ટાંકી સામે રામનગર સાબરમતી) તા.૨૨/૮/૧૮ કલાક ૧૦/૧૫ વાગ્યાના સુમારે સાબરમતી રામનગર જૈનોના સંઘના બહેનોના ઉપાશ્રય આગળથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક્ટીવા નંબર ૮૩૧૩ ઉપર આવેલ પુરૂષ પાણલબહેનના ગળામાંથી સોનાની ચેઈન કિંમત રૂપિયા ૩૬,૨૫૩/- ખેચી તોડી લઈ નાસી ગયો હતો. આ અંગેની ફરીયાદ પાણલબહેન શાહે તા.૨૫/૮/૧૮ નારોજ સાબરમતી પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એ.જે.દેસાઈ ચલાવે છે.

એરપોર્ટ: માલવીકા વા/ઓ રાજેશકુમાર ચૌહાણ (ઉ.વ.૪૭) (રહે. સુંદરવન સોસાયટી નોબલનગર સરદારનગર) તા.૨૫/૮/૧૮ રાતના ૮/૪૫ વાગ્યાના સુમારે કોતરપુર ટર્નીંગ નજીકથી પતિ સાથે મોટર સાયકલ પાછળ બેસી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક મોટર સાયકલ ઉપર આવેલ બે પુરુષ માલવીકાબહેનના ગળામાંથી સોનાનો દોરો કિંમત રૂપિયા ૫૦,૦૦૦/- ખેચી તોડી લઈ નાસી ગયા હતા. આ અંગેની ફરીયાદ માલવીકાબહેન ચૌહાણે એરપોર્ટ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી એમ.બી.મિસ્ત્રી ચલાવે છે.

કૃષ્ણનગર: રેખાબહેન મુરલીધર થાવાણી (ઉ.વ.૬૨) (રહે.ટેપુરામ સોસાયટી કિશોર સ્કૂલ સામે બંગલા એરિયા મેઘાણીનગર) તા.૨૪/૮/૧૮ રાતના ૧૧/૪૫ વાગ્યાના સુમારે કૃષ્ણનગર સૈજપુર બોધા સૈજપુર ટાવર રોડ રાધેશ્યામ મંદિર આગળથી એક્ટીવા ચલાવી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક મોટર સાયકલ ઉપર આવેલ બે પુરુષ રેખાબહેનના ગળામાંથી સોનાનું મંગળસુત્ર કિંમત રૂપિયા ૭૦,૦૦૦/- ખેચી તોડી લઈ નાસી ગયા હતા. આ અંગેની ફરીયાદ રેખાબહેન થાવાણીએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી પી.કે.દવેરા ચલાવે છે.

વાહન અકસ્માતમાં મૃત્યુ:-

સમાચાર યાદી નં.૧૬૫૧/૧૮

બાપુનગર: મુકેશભાઈ સ/ઓફ હામાભાઈ ચૌહાણ (ઉ.વ.૨૭) (રહે. ગાંધીપાર્ક સોસાયટી બળીયાકાકા ચાર રસ્તા પાસે રખીયાલ) તા.૨૪/૮/૧૮ રાતના ૧૧/૪૫ વાગ્યાના સુમારે સોનેરીયા બ્લોક સામે અમર પ્રીંટરી ઓફીસની સામેથી મોટર સાયકલ ચલાવી પસાર થઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા મોટર સાયકલના ચાલકે મોટર સાયકલ પુરઝડપે અને બેદરકારીથી ચલાવી મુકેશભાઈના મોટર સાયકલને ટક્કર મારતા મુકેશભાઈને ગંભીર ઈજાઓ થતા મુકેશભાઈનું મૃત્યુ નિપજ્યું હતું. આ અંગેની ફરીયાદ મૃત્યુ પામનાર મુકેશભાઈના ભાઈ ગીરીશભાઈએ બાપુનગર પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી સી.એમ.કાંટેલીયા ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.